



પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય

આણંદ કૃષિ યુનિવર્સિટી,

આણંદ - ૩૮૮૦૦૧



પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદનાં વિદ્યાર્થી સંઘ પરિષદ દ્વારા પશુપોષણ વ્યાવસાયિક નિર્ભરતા અંગેનાં પ્રવચનનું આયોજન

આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયનાં અશ્વિની સેમિનાર હોલ ખાતે તા. ૦૯/૦૮/૨૦૧૮ નાં વિદ્યાર્થી સંઘ પરિષદ દ્વારા નવમાં સત્રનાં સ્નાતક એવં મહાવિદ્યાલયનાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે પશુપોષણ વ્યાવસાયિક સ્વાવલંબનનાં માર્ગદર્શન હેતુસર એલટેક (Alltech), એનીમલ ન્યૂટ્રિશન કંપની તરફથી પ્રવચનનો કાર્યક્રમ યોજાયેલ હતો. પ્રવચનની શરૂઆત પહેલાં મહાવિદ્યાલયનાં ડીન અને આચાર્યશ્રી ડો. એ.એમ. ઠાકર દ્વારા પ્રવક્તાઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી, આ પ્રકારનાં પ્રવચનોની મહત્વતાં અને તેનાં થકી પ્રાપ્ત થતી તકોને સમજીને વ્યાવસાયિક સ્વાવલંબન કઈ રીતે મળી શકે, તે અંગે માહિતી મેળવવા વિદ્યાર્થીઓને અનુરોધ કરેલ હતો. એલટેક એનીમલ ન્યૂટ્રિશન કંપનીનાં માર્કેટીંગ મેનેજરશ્રી, ડેરી અને એક્વા (સાઉથ એશિયા)નાં મિસ વિની માધુરીએ પશુપાલન એવં ડેરી ક્ષેત્રે વિશ્વકીય સાંપ્રત તકોની અને પશુઆહાર વિશે વિશદ છણાવટ કરી, પોતાની કંપનીમાં પ્રાપ્ત થતી તકોની સંપૂર્ણતયા માહિતી આપેલ હતી. તેમણે તેમની એલટેક એનીમલ ન્યૂટ્રિશન કંપની દ્વારા એલટેક યંગ સાયન્ટીસ્ટ હરીફાઈ અંગે તલસ્પર્શી માહિતી પણ આપેલ હતી. તેમની સાથે પધારેલ તેમના સહયોગી ડો. ભુષણ દેશમુખ, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરશ્રી (ડેરી) દ્વારા આ હરિફાઈની અગત્યતાં સમજાવી, તેમનાં નવીન સંશોધનોમાં તેના દ્વારા પ્રાપ્ત થતી ઉપયોગિતા સમજાવી હતી. તેમણે વિદ્યાર્થીઓ સાથે ટૂંકી સ્પર્ધાત્મક કસોટી કરી તેમને ઈનામથી પ્રોત્સાહિત કરેલ હતાં અને તેમની કંપની દ્વારા આયોજીત એલટેક યંગ સાયન્ટીસ્ટ સ્પર્ધામાં ઓનલાઈન માહિતી મેળવી ભાગ લેવાં અનુરોધ કરેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. એસ.કે.રાવલ, પ્રાધ્યાપક અને વડાશ્રી, મેડિસીન વિભાગે કરેલ હતું. અંતમાં વિદ્યાર્થીસંઘનાં મહાવિદ્યાલયનાં નિયામકશ્રી ડો. જે.બી. નાયકે આભાર વિધિ કરેલ હતી.



પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી,
આણંદનાં વિદ્યાર્થી સંઘ પરિષદ દ્વારા પશુપોષણ વ્યાવસાયિક નિર્ભરતા
અંગેનાં પ્રવચનનું આયોજન